

505-508, TEN/11, Beside Mardia Plaza, C.G. Road, Ahmedabad - 9. Ph.: 079-48990505 / 48990606 Telefax: 079-26406810

www.shrenik.co.in • e-mail : info@shrenik.co.in

CIN No.: L51396GJ2012PLC073061

Date:28.07.2023

To, The Manager, **The National Stock Exchange of India Limited,** Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (E), Mumbai – 400 051, Maharashtra, India

COMPANY SYMBOL: SHRENIK

<u>Subject: Newspaper Advertisement of unaudited financial results for the quarter ended 30thJune, 2023</u>

Dear Sir,

PursuanttoRegulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015 the company has given Newspaper Advertisement in one (1) English – Business Standard and One (1) Regional language Newspaper- Gujarati – Financial Express for unaudited financial results of the quarter ended 30th June, 2023.

Kindly take the same on your records.

Thanking You.

Yours Faithfully

FOR, SHRENIK LIMITED

RISHIT VIMAWALA

WHOLE TIME DIRECTOR

DIN: 03474249

Wholesale Distributors:

TNPL Tamilnadu Newsprint & Papers Ltd.



Year Ended
 Quarter Ended
 Year Ended

 30/05/2023
 30/05/2022
 31/03/2023

 9.93
 6.76
 1161.99

 1.67
 -10.57
 81.95
 Profit before Exceptional Items and Tax Total Comprehensive Income (After Tax) -10.57 78.57 Total Comprehensive Income (After Tax) 2.39 -10.57 78.57 Paid up Equity Share Capital (of Rs. 10/- Each) 648.33 648.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 646.33 64

lace: Vadodara ate: July 26, 2023

For Jhaveri Credits and Capital Ltd.



Ahmedabad Regional Office : 4" floor, Sakar VII,
Nehru Bridge Junction, Astram Road, Navrangpura,
Nehru Bridge Junction, Astram Road, Navrangpura,
Astram Road, Navrangpura,
Email : ro1018@sib.co.ân, Phone No. 079 – 2658 5600, 5700, 1600

AUCTION SALE NOTICE

ADIO WIGHERAS, the Borrower / Guarantor have failed to pay the amount, Notice is hereby given that the immovable properties and Wighter from the Schedule hereunder will be sold by vay of Tender Cum Auction on "as is where is" basis, "as is what "and "Whatever them is "condition (white respect to the lies, nature and physical status of the second easilyst), on the date and lege piece mentioned hereit below for realization of a sum of Rs. 79.26.26.20.2 (Rupees Seventy Nine Liah Twenty Six Thoussand receiving and Palas Provided (South Second Conference) and the Conference of the C

		,					
Name of Property Owners		Mrs. Ramilaben Manubhai Rajgor					
Description of Property	building havi Municipality appurtenant owned by Mi Rapar Sub-Re	All that part and parcel of land to an extent 167.28 Sq. Mts., bearing 'Plot No. 24 paix and 25 paix along with upding having total laukilup area of about 74.73 Sq. Mts. a Radhekrishna Street, Ayodhyapur, Rapur, Rapar, unicipality property No. 31/39 and all other constructions, improvements, essementary rights existing and popurtenant thereon comprised under flevenue. Sy No. 15, shusted at Rapar Village, Tabuk, kutch District and waved by Mss. Ramilbane Manubbla Right, growner flully described in Sale Deed No. 4165 dated 15.10ct 2017 of Rapar Sub-Registration District and Bounded by s. North: House of Mail Hirbane Mandeva, East; Road, South House of Joshi Manchibhen Jaishanker; on Por No. 25 paisk, West: House of Mail Kirikaman Gloiror.					
Reserve Price	Rs. 27,50,00	0/- (Rupees Twenty Seven Lakh Fifty Thousand Only)					
Deposit (EMD) shall be paid		-(Rupees Two Lakh Seventy Five Thousand Only) son or before 05.00 PM on 13.09.2023 by way of DD drawn in favour of "The Authorised Officer, The South td." payable at Ahmedabad or through RTGS/NEFT to Account No 0178073000010463 held by The					

14.09.2023 at 01.00 PM at The South Indian Bank Ltd., Plot No 274, Ward No.12/B, Hinduja Ct Market, Gandhidham Kutch- Gujarat, Pincode: 370201. Contact Person : Mr. Gandhi Navinchandra, Ph. No.: +91-7984146823 or Mr. Ashish C Kadam, Ph. No.: +91-8879278772

late : 27.07.2023, Place : Bhu

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD.
Registered Office: 4th Floor, Narayan Chambers, 8th. Patang Hotel, Ashram Road, Ahmedabad – 380 009. Contact Person: Mr. Bharat J. Bhatt, Mobile No.97141 99018.
SALE OF IMMOVABLE PROPERTIE

E-Audion Sale Motice of the Immovable Assets under the Securitization and Reconstruction of the Financial Asset and Enforcement of Security Interest Act, 2002 read with provise to Rule 8(6) of the Security Interest (Enforcement Rules 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor is. MAS Rural Housing & Mortgage Finance Ltd. The physical possession of which has been taken by the authorized officer of MAS Rural Housing & Mortgage Finance Ltd. The physical possession of which has been taken by the authorized officer of MAS Rural Housing & Mortgage Finance Ltd. The physical possession of which has been taken by the authorized officer of MAS Rural Housing & Mortgage Finance Ltd. The physical possession of the security of

ı	Where is, and Whatever There is without any Recourse E	Basis" for realization of company's dues.
	1. BORROWER/S & GUARANTOR/S NAME & ADDRESS 2. TOTAL DUE + INTEREST	DESCRIPTION OF THE PROPERTY A/C NO. FOR DEPOSITING EMD/OTHER AMOUNT
Mastilya Road, Dared, Jammagar, Gujarat, 367 005. Manjulaben Rajubhai Vagh (Co-borrowen), Hawing Address At: 153/4, Shiv Park, Opp Alpha School, Mastilya Road, Dered, Jammagar, Gujarat, 367 005. Amount Rs. 8,96,9504—As Per Demand Motice Dated 01/07/2021 + Interest Till The Date of Realization And Cost, Charges And Other Expenses.		1.All That Piece & Parcel of Property Bearing Plot No.65/2, Admessuring About 421 159, Mits: & Construction Thereon, in Scheme Known As "Murlidh Park-2" Situated At Revenue Survey No.31/paik-1 (new Revenue Survey No.61), Al. Dared, Ta. Jammagar, in He Registration District & Sub District of Jammagar, Gujerat. 2. Account No.505504040000003; Bark Name: Union Bark Of India; IPSC Code: UBIN05505333; MICR CODE: 380026003.
	DATE & TIME OF E-AUCTION LAST DATE OF SUBMISSION OF EMD DATE & TIME OF THE PROPERTY INSPECTION	1. RESERVE PRICE 2. EMD OF THE PROPERTY
	1) E-AUCTION DATE: 06/09/2023 11:00 AM TO 01:00 PM WITH FURTHER EXTENSION OF 5 MINUTES 2) LAST DATE OF SUBMISSION OF EMD WITH KYC 04/09/2023 - TILL 05:00 PM 3) DATE OF INSPECTION: ON 01/09/2023 - BETWEEN	RESERVE PRICE (IN INR): RS.6,95,100/- (RUPEE SIX LAKH NINETY FIVE THOUSAND ONE HUNDREI ONLY) EMD AMOUNT (IN INR): RS.69,510/- (RUPEE SIXTY NINE THOUSAND FIVE HUNDRED TEN ONLY)

10:00 AM TO 05:00 PM IST STATUTORY 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002

vers / Co-Borrowers / Guarantors are hereby notify to pay the sum as mentioned in the demand noticate interest and ancillary expenses before the date of e-auction, failing which the property will be auclance dues, if any, will be recovered with interest and cost.

I described to the control of Sale news and for to the link https://sarfaesi.auctiontiger.

For further detailed terms and conditions of Sale, please refer to the link https://sarfaesi.auctiontiger.net al: available at MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD. website i.e. https://www.mrhmfl.co.in/

Authorized Officer
MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD.



MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD.
Registered Office. 4th Floor, Narayan Chambers, Bh. Patang Holal, Ashram Road,
Ahmedabad – 380 009. Contact Person: Mr. Bharal J. Bhast, Mobile No.97141 99018.

ALE OF IMMOVABLE PROPERTIES

Ameniana—a source, contain retirem for a minural belian (when the Securitization and Reconstruction of the Immovable Assets under the Securitization and Reconstruction of the Financial Asset and Enforcement of Security Interest Act, 2002 read with provise to Rule 6(6) of the Security Interest (Enforcement Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable properly mortgaged / charged to the secured creditor i.e. MAS Rural Housing & Mortgage Finance Ld. The physical possession of which has been taken by the authorized officient MAS Rural Housing & Mortgage Finance Ld. in the Loan Account No.635 with a right to sale the same on "As is What is, As i Where is, and Whatever There is without any Recourse Basis "for realization of company sold control of company sold and the second of the second

1. BORROWER/S & GUARANTOR/S NAME & ADDRESS 2. TOTAL DUE + INTEREST	DESCRIPTION OF THE PROPERTY A/C NO. FOR DEPOSITING EMD/OTHER AMOUNT
1.Bijay Kanubhai Bahera (Borrover), Having Address At. Syno. 290, 01d H.no. 11, New H.no. 23 GPrajapani Mantolia, Moli Ved. Journal, Gujarat. 394110. Mangela Bijaybhai Bahera (Co-borrower), Having Address At. Syno. 290, 01d H.no. 1/25, New H.no. 23, Gr Fl Back Side Prajapati Mahaolia, Nr. Om Karesthwar Mantoli, Moli Ved. Strat. Gujarat. 395004. Akhayakumar Bijaybhai Bahera (Co-borrower), Having Address At. Syno. 290, 01d H.no. 1/25, New H.no. 23, Gr Fl Back Side Prajapati Mahaolia, Nr. Om Karesthwar Mantoli, Mol Ved. Strat. Gujarat. 395004. Bharatbhai Kanubhai Patel (guarantor), Having Address at. B. 103, Parivar Apprtment, Sayan Road, Amroli, Surat, Gujarat. 395004. 2. Amount Res. 297, 720f.—as per Demand Notice Dated 1001/12022 + Interest Till The Date of Realization and Cost, Charges and other Expenses.	4.All That Piece And Parcel Of Property Bearing Residence Flat No. 915, Admessing Built Up Are 83,728 Sq. Mirs., In Schoel Sq. Mirs. Mirs. Sq. Mirs. Sq. Mirs. Sq. Mirs. Mirs. Sq. Mirs. Sq. Mirs. Sq. Mirs. Sq. Mirs. Mirs. Sq. Mirs. Mirs. Sq. Mirs. Sq. Mirs.
DATE & TIME OF E-AUCTION LAST DATE OF SUBMISSION OF EMD DATE & TIME OF THE PROPERTY INSPECTION	1. RESERVE PRICE 2. EMD OF THE PROPERTY
1)E-AUCTION DATE: 0609/2023 11:00 AMTO 01:00 PM WITH FURTHER EXTENSION OF 5 MINUTES 2) LAST DATE OF SUBMISSION OF EMD WITH KYC 04/08/2023 – TILL 05:00 PM 3) DATE OF INSPECTION: ON 01/09/2023 – BETWEEN	1. RESERVE PRICE (ININR): RS 3.60,000/- (THREE LAKH SIXTY THOUSAND ONLY) 2.EMDAMOUNT (IN INR): RS 3.6,000/- (THIRTY SIX THOUSAND ONLY)

10:00 AM TO 05:00 PM IST STATUTORY 30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT. 2002

The Borrowers (Co-Borrowers (Guarantos are heet) only to pay the sum as mentioned in the demand notic with up to date interest and ancillary expenses before the date of e-auction, failing which the property will be ausoid and balance dues, if any, will be recovered with interest and cost.

For further detailed terms and conditions of Sale, please refer to the link https://sarfaesi.auctiontiger.auailable at MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD, website i.e. https://www.mrhmfl.co.in/

Place: Surat Date: 28/07/2023 Authorized Officer
MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LTD.

DEBTS RECOVERY TRIBUNAL-II Outward No.1254/2 (Ministry of Finance, Government of India)
3rd Floor, Bhikhubhai Chamber, 18, Gandhi Kunj Socie
Opp. Deepak Petrol Pump, Ellisbridge, AHMEDABAD-380

O.A.65/2023 NOTICE THROUGH PAPER PUBLICATION EXb. No.06

APPLICANT VERSUS IRS. PRITI YASH MISHRA & ORS

, MRS. PRITI YASH MISHRA

whereas the application for substituted service animary and whereas the application for substituted service its Tribunal.

Defendant are hereby directed to show cause as to why the Original and the allowed. louid not be allowed.

You are directed to appear before this Tribunal in person or through an A
11.10.2023 at 10.30 a.m. and file written Statement / Reply with a copy
mished to the applicant upon receipt of the notice.

Take notice that in case of default, the Application shall be heard and de
ura sheence.

IVEN UNDER MY HAND AND SEAL OF THE TRIBUNAL. ON THIS 15th JULY. 2023 PREPARED BY CHECKED BY



Shrenik Limited
CIN: L51396GJ2012PLC073061
e: 505-503. TEN11. Beside Mardas Plaza, C.G. Road,
e: 505-503. TEN11. Beside Mardas Plaza, C.G. Road,
og. Gujarat. Tel: (079) 2644030GTelefax; (079) 26406810
6 shrenik.co.n Website: www.shrenikidi.com
ment of the Unaudified Financial Results for the quarte
ended 30 June, 2023

				(ns. III Lacs)	
SI. No.	Particulars	Quarter ended 30 th June, 2023	Quarter ended 30 th June, 2022	Year ended 31st March, 2023	
1.	Total Income from Operations	859.84	1199.52	4855.63	
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4880.70)	83.04	8.93	
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(4745.02)	83.04	11.26	
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4745.02)	83.04	22.94	
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(4745.02)	83.04	22.94	
6.	Equity Share Capital	6120	6120	6120	
7.	Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	(0.77)	0.01	0.00	

Shrenik Vimawala Chairman & Managing Director Place : Ahmedabad Date : 27.07.2023

PUBLIC NOTICE

NOTICE is hereby given that "1.5H. HEMANT MAHENDRAKUMAR @ MANGALDAS THAKKAR & 2.5MT. BEENA HEMANTBHAI THAKKAR" (hereinafter referred to as the said Mortgagors/Borrowers/Proposed Purchasers) have created mortgage in respect of the Property more particularly described in the Schedule hereunder in favour of myfour clients IDFC first Bank Limited (Branch Address Mazenine Floor, 02nd Floor, international That Present) owner 5th. HEMANT MAHENDRAKUMAR @ MANGALDAS THAKKAR had acquired the Title of NONDIN NO. 716-AS NONDIN NO. 716-B through Registered Beleased Deed Only. That 1. Lataben Mangaldas Thakkar & 2.5. N. Hemant Mangaldas Thakkar bad purchased the said Nondh No. 716/A through Registered Sale deed, Lataben Mangaldas Thakkar expired on 10/07/2019. Prior to her death "Sh. Mahendrakumar @ Mangaldas Chunilal Thakkar" expired On 02/11/1996, accordingly remaining Legal Heirs Viz: "1.5 h. Hemant Mahendrakumar in Fakkar & 2.5 h. Hemant Chunilal Thakkar & 2.5 h. Hemant Mahendrakumar (Pakkar) and purchaved the said Nondh No. 716-A, ister 5rm. Aarti Bimal Thakkar (O) Mahendrakumar Chunilal Thakkar valured by Sh. Mahendrakumar (Pakkar) (Pakkar) and purchaved the said Nondh No. 716-A, ister 5rm. Aarti Bimal Thakkar (O) Mahendrakumar Chunilal Thakkar had purchased the said Nondh No. 716-A, ister 5rm. Aarti Bimal Thakkar (O) Mahendrakumar Chunilal Thakkar (Pakkar) (Pakkar)

Ratilal Pachchigar 2 Sh Paresnonar Amanuma rendengar.

Registered Release Deed.

That "1. SH. HEMANT MAHENDRAKUMAR THAKKAR & 2. SMT. BEENA HEMANTBHAI THAKKAR" h.

Purchased the said Nondh No. 7.17 from "1. Smt. Ashaben Wd/o Anlikumar Ratilal Pachchigar, 2. S.

Pareshbhai Anlikumar Pachchigar, 3. Sh. Rupeshbhai Anlikumar Pachchigar" through Registered Sale Dee

Paresnoral Annualist Teachings, South Comp.

That FOLLOWING DOCUMENTS were loss and misplaced for the reason being from Previous Ow Non Availability at their end.

	NONDH No. 716/A	
16/07/1960	Registration Receipt of Sale Deed Reg. No. 1477 of 1960 alongwith Copy of Index II	Original
19/11/1960	Registered Gift Deed executed in favour Of "Sh. ZinabhaiManeklal" alongwith	Original
	Registration Receipt & Copy of Index II	
Last	Death Certificate Of Late Sh. Zinabhai Maneklal"	Original
Last	Death Certificate Of Late "Padmavati Zinabhai	
Last	Family Tree i.e. Pedhinama Of Late "Sh. Zinabhai Maneklal	Original
//	Registered WILL Of Late 'Padmavati Zinabhai	Original
07/07/2000	Registration Receipt OF Sale Deed Reg. No. 3654 Of 2000	Original
	NONDUN BACA	
	NONDH No. 716/B	

	NONDH NO. 710/B						
16/07/1966 Sale Deed Reg. No. 1977 Of 1966 alongwith Registration Receipt & Copy of Index II							
07/07/2000	Registration Receipt OF Sale Deed Reg. No. 3655 Of 2000	Original					
NONDH No. 717							
Latest	Family Tree i.e. Pedhinama Of Late "Sh. Anilkumar Ratilal Pachchigar	Original					
That if any body is having Rights or interest & who claimed as Legal Heirs of Late Sh. Vinodchandra Mangaldas							
Thakkar in respect of Nondh No. 716/B & Lataben Mangaldas Thakkar (For Nondh No. 716/A & 716/B) & Sh.							

Annual retails retain retaining it of Notion no. 17 in the above mentioned repetryles, except mentioned as retaining to or touching upon said property by any means Or any exament, maintaining to the chaining to or touching upon said property by any means Or any exament, maintainnance, inhertiance testamentary deposition or otherwise or having in their custody any title, documents pertaining the said retaining the said communicate the same to the undersigned at my address within 10 days from the publication of this notice with documentary evidence in support thereof, falling which all the claim, of such person shall be considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days the considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days the considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days the considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days the considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days the considered to have been waived and or abandoned. Any objections raised after the completion of the 10 days the considered to have the considered to the con said flat/Property or my Client.
THE SCHDEDULE ABOVE REFERRED TO

ıb-District & Taluka: Surat City, Gopipura Havadiya Chakla, Limdikui Main Road Area, City Survey No. 10 Paikee

Sr. No.	NONDH No.	
1		admeasuring 31.77.29 sq. mtrs., As Per Municipal Records admeasuring 62.72 sq. mtrs.,
2	716/B	admeasuring 22.57.55 sq. mtrs., As Per Municipal Records admeasuring 46.83 sq. mtrs.,
3	717	admeasuring 63.54.58 sq. mtrs., As Per Municipal Records admeasuring 156.83 sq. mtrs.

Place: SURAT A/410, TIRUPATI PLAZA, b/s. Bahumali Buildin Dated this 27th July, 2023

Dineshchandra S. Ahire (Advocate & Notary)

☆ Karnataka Bank Ltd.

E-AUCTION PUBLIC NOTICE OF SALE

Off: +91-261-2477600 Mob: +91-98245 09367

E-AUCTION SALE NOTICE OF IMMOVABLE PROPERTY ON 17.08.2023

artivias under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with p Auction Sale Notice for Sale of Immovable Propertylies under the Securitisation and Reconstruction of Financial Assets and Entirectment of Security interest Act, 2002 raad with proviso to knowledge (1) (Rule 4(f)) of the Security Interest (Financian Financial Assets) and Entirectment (Security Interest (Financian Financian F

Si No.	Branch Name	Name & Address of the Borrowers / Guarantors	Balance C in Rs.	D/S		Description of the Property/ies	Reserve Price (Rs.) Earnest Money Deposit (EMD) Rs.	Date & Time of Auction Incremental Value of the Bid	Details for Remitting EMD Account No. / IFSC Code		
1	Vadodara	Nr. Kharwa Nivedita N, W/o Mr. Kharwa Nilesh J, Nr. Kharwa Nilesh J, S/o Jagdishchandra C Kharwa, Both 1 and 2 addressed at: 22.	Rs.23,04,554.80 Twenty Three La Thousand Five Hu Four and Paise Ei	khs Four ndred Fifty ghty Only]	Floor, in the sci Glory, Bil-Vadoo proportionate sh Block No.561 (0	parcel of Residential Property being Flat No.K-104, First heme "The Mark", Behind Pratham Riviera, Near Kishan dara admeasuring about built up area 78.96 sqmtrs and are in land admeasuring 41.49 sqmtrs situated on the lands Did RS No.780), admeasuring 11,736 sqmtrs and of Block	Rs.21,68,000.00 (Rupees Twenty One Lakhs Sixty Eight Thousand Only)	17.08.2023 from 11.10 AM to 11.30 AM	RTGS Account Number: 7933500200004101 Account Name: Karnataka Bank		
		Saket Duplex, Opp. Petrol Pump, Baranpura, Vadodara, Gujarat 390001	No.793700180014 with future inter	9801 along Mouje, Bil Taluk est from N. Boundaries		No.7937001800149801 along with future interest from		No.781) admeasuring 3,845 sqmtrs situated in the Village a and District Vadodara, belonging to Mrs. Kharwa Nivedita of Property: East by: Flat No.K-101; West by: 7.30 Mtr Lagu/Adjoining Survey Number; South by: Flat No.K-103.	Rs.2,16,800.00 (Rupees Two Lakhs Sixteen Thousand Eight Hundred Only)	Rs. 10,000/-	Ltd, Vadodara Branch, IFSC Code - KARB0000793
.					Possession D	Date / Type of Possession :- Physical Possession Ta					
,	Vadodara	1) Mr. Kharwa Nilesh J, Sio Rs. 30,57,061.49 [Rupees Mr. Jagdishchandra C Kharwa. Thiyl, Ladish Filly Swerin Thousand Stryt One and Mr. Kharwa Nilesh J, Both 1 and 2 addressed at 1:2. Sanket Duplex. Opp. Petrol Pump. Baranpua, Vatodiara, Sujarat 300001		y Seven One and Only] under	Vadodara, admeasuring about plot area 61.85 sqmtrs and proportionate undivided share of common plot 25.53 sqmtrs situated on land bearing Block		Rs.37,10,000.00 (Rupees Thirty Seven Lakhs Ten Thousand Only)	17.08.2023 from 11.30 AM to 11.50 AM	RTGS Account Number: 7933500200004101 Account Name:		
-	Branch			0201 along est from	No.673) admeas Mouje Bil Taluka belonging to Mr.	by admissioning 7995 signins and book No.506 (cut RS suring 8903 smfrs, total aggregating 19,628 sqmfrs of Village I, Vadodara District along with building constructed thereon, Kharwa Nilesh J. Boundaries of Property: East by: Plot Society Road; North by: Plot No.61; South by: Plot No.63.	Rs.3,71,000.00 (Rupees Three Lakhs Seventy One Thousand Only)	Rs. 10,000/-	Karnataka Bank Ltd, Vadodara Branch, IFSC Code - KARB0000793		
					Possession D	ate / Type of Possession :- Symbolic Possession Ta	sken on 05.05.2022		•		
		(c) Mr. Bharat Tapubhai Santoki (d) Mr. Rasikhhai Tapubhai Santoki and (e) Mr. Santoki Navinbhai, Addressed at: 124, Planery Arcade, Near Bombay Petrol Pump, Gondal Road, Rajkot, Gujarat-360001; 2. Mrs. Aloaben Bharatbhai Santoki.		,343/- [Rupees e Thirty Lakhs	All that part and parcel of residential property in "Top Land Residency", bearing Plot No.63/K, admeasuring 98.54 Sq.Mirs, Plot No.63/K, R.S. No.60/I Palki & 60/2 Palki & 60/3 Palki 4 & 61/2 Palki & 61/3 Palki T.P.S. No.4 E.P. No.759, 760 & 76/2 Palki of Village Raiva known as "Too	(Rupees Ninety Lakhs Only)	17.08.2023 from 11.30 AM to 11.50 AM				
				ven Thousand lundred and liree Only] i.e. ,042.00 under	Land Residency, Taluka & District Rajkot, Gujarat, belonging to Mrs Santoki Manishaben: Boundaries of Property: East by: Other's Property, West by: 7.50 Mt. Wide Road, North by: Plot No. 62/K, South by: Plot No. 64/K	Rs.9,00,000.00 (Rupees Nine	Rs. 10,000/-	RTGS Account Number: 6583500200004101			
3	Rajkot	addressed at: 124, Planery Arcade Petrol Pump, Gondal Road, Rajko			L A/c No. 00171601 along	All that part and parcel of Commercial Shop No.124,	Rs.12,18,000.00	17.08.2023	Account Name: Karnataka Bank		

		Baranpura, Vadodara, Gujarat 390001	with future inter- 14.07.2023, plu			Kharwa Nilesh J. Boundaries of Property: East by: Plot Society Road; North by: Plot No.61; South by: Plot No.63.	Lakhs Seventy One Thousand Only)	10,000/-	Branch, IFSC Code - KARB0000793	
		Possession Da				ate / Type of Possession :- Symbolic Possession Taken on 05.05.2022				
		Ms Shaakar Build Services, a represented by its Partners: (a) I Bharatbhai Santoki, (b) Mrs. Par (c) Mr. Bharat Tapubhai Santoki Tapubhai Santoki and (e) Mr. Sai	Mrs. Alpaben ulben R Santoki (d) Mr. Rasikbhai	One Crore	343/- [Rupees Thirty Lakhs	All that part and parcel of residential property in "Top Land Residency", bearing Plot No.63/K, admeasuring 98.54 Sq.Mirs, Plot No.63/K, R.S. No.60/I Palki & 60/2 Palki & 60/3 Palki 4 & 61/2 Palki & 61/3 Palki T.P.S. No.4 E.P. No.759, 760 & 762 Palki of Village Raiva known as "Top	Rs.90,00,000.00 (Rupees Ninety Lakhs Only)	17.08.2023 from 11.30 AM to 11.50 AM		
Rajkot Branch	Addressed at: 124, Planery Arcac Petrol Pump, Gondal Road, Rajkol 2. Mrs. Alpaben Bharatbhai San 3. Mrs. Parulben R Santoki, No.3	le, Near Bombay ;, Gujarat-360001; toki, 2 and 3 are	Forty Seven Thousand Three Hundred and Forty Three Only] i.e. Rs.19,37,042.00 under		Land Residency, Taluka & Oistrict Rajkot, Gujarat, belonging to Mrs Santoki Manishaben: Boundaries of Property: East by: Other's Property, West by: 7.50 Mt. Wide Road, North by: Plot No. 62/K, South by: Plot No. 64/K	Rs.9,00,000.00 (Rupees Nine	Rs. 10,000/-	RTGS Account Number: 6583500200004101		
	addressed at 124, Pienney Arcade, Near Bombay Petrol Puring, Contal Rosa, Rajach Calpara-Sigotor; 1 4. Mr. Bharat Tayubhal Santoki, Addressed at Fish, No.01, Nand Nekan, Near Patiator Chowk, Inside Nand Cay, Rajach-Sidotos; S. Mr. Rasishthal Impubhal Santoki, Addressed at: Pienney Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carlon, Carl		PSTL A/c No. 6587001800171601 along with future interest from 01.07.2023 and Rs.1,11,10,301.00 under PSTL A/c No.6587001800174601 along with future interest from 27.06.2023, plus costs		All that part and parcel of Commercial Shop No.124, situated on the first floor of the building known as "Planery Arcade", constructed on the land admeasuring total 1039.77 sq.mtr, Survey No. 2899, Ward No.7/2 of Rajkot and situated at Gondal Road, Rajkot, Gujarat,	Lakhs Eighteen	17.08.2023 from 11.50 AM to 12.10 PM	Account Name: Karnataka Bank Ltd, Rajkot Branch, IFSC Code -		
					belonging to Mr. Navinkumar Santoki. Boundaries of Property : East by: Shop No.125; West by: Shop No.121; North by: Entrance of Shop & Passage; South by: Shop No.123.	(Rs. One Lakh Twenty	Rs. 10,000/-	KARB0000658		
l		Sadhu Vasvani Road, Block No.113	, Rajkot-360004.			Possession Date / Type of Possession :- Syn	nbolic Possession	Taken on 0	2.12.2022	
		(1) M/s Stallion Energy Pvt. Ltd. company represented by its Direct Kuldeepsinh Bhikubhai Basiya, (b Kuldeepsinh Basiya, addressed at	tors: (a) Mr.) Mrs. Smitadevi :: 305-D, Imperial		,11,230.99 Two Crore	Item No.1: All that part and parcel of Commercial Office No.929 and 930 together admeasuring 65.80 sqmtrs (superbuilt up area), situated at 9th Floor, Star Plaza, Near Circuit House, constructed on land of City Survey Ward No.16. City Survey No.2547 paiki, Phulchhab Chowk,	Rs.42,50,000.00 (Rupees Forty Two Lakhs Fifty Thousand Only)	17.08.2023 from 4.00 PM to 4.20 PM		
	(2) Mr. Kuldeepsinh Bhikubhai Basiya, S/o Mr. Bhikubhai Basiya; (3) Mrs. Smitadevi Kuldeepsinh Basiya, W/o		Eleven La Thous Hundr	akhs Eleven and Two ed Thirty ise Ninety	Rajkot, belonging to Mr. Kuldeepsinh, Bhikubhai Basiya. Boundaries of Property: East by: Office no.928; West by: Office no.901; North by: Common passage; South by: Open marginal space.	Rs.4,25,000.00 (Rs. Four Lakhs Twenty Five Thousand Only)	Rs. 10,000/-	RTGS Account Number: 6583500200004101 Account Name:		
	Rajkot Branch	No. 2 and 3 add. at: Ravi Manor Apartment, 301, 3rd Floor, Opp. Amin Vando, Amin Marg, Rajkot - 360005; (4) Mr. Nilendrakumar B Basiya, S/o Mr. Bhikubhai Basiya; addressed at: Trisha Bungalow, Block No. 1,			Only1	Item No.2: All that part and parcel of Commercial Office	Rs.21.25.000.00	17.08.2023	Karnataka Bank	
		Floor, Opp. Amin Vando, Amin Man (4) Mr. Nilendrakumar B Basiya, Basiya; addressed at: Trisha Bun	g, Rajkot - 360005; S/o Mr. Bhikubhai	under C 6587000 along v	DD A/c No. 100033601 with future	No.330 admeasuring 32.90 sqmtrs (superbuilt up area), situated at 3rd Floor, Star Plaza, Near Circuit House, constructed on land of City Survey Ward No.16, City Survey No.2547 paiki, Phulichhab Chowk,	(Rupees Twenty One Lakhs Twenty Five Thousand Only)	from 4.20 PM to 4.40 PM	Ltd, Rajkot Branch, IFSC Code - KARB0000658	
		Floor, Opp. Amin Vando, Amin Mar (4) Mr. Nilendrakumar B Basiya,	g, Rajkot - 360005; S/o Mr. Bhikubhai galow, Block No.1, pany, partnership a) Mr. Kuldeepsinh kumar B Basiya,	under C 6587000 along v intere	DD A/c No. 100033601	situated at 3rd Floor, Star Plaza, Near Circuit House, constructed on land of City Survey World No 16, City Survey No 2547 paiki, Phutchhab Choxwi, Rajkot, belonging to Mis Hindustan Trading Co. Boundaries of Property: East by: Open marginal space; West by: Office no 329.	One Lakhs Twenty Five Thousand Only) Rs.2,12,500.00 (Rupees Two Lakhs Twelve Thousand Five Hundred Only)	from 4.20 PM to 4.40 PM Rs. 10,000/-	Branch, IFSC Code - KARB0000658	
		Floor, Opp. Amin Vando, Amin Mari (4) Mr. Nilendrakumar B Basiya; Basiya; addressed at: Trisha Bun Amin Marg, Rajkot - 360005; (5) Mis Hindustan Trading Com Jirm represented by its partners: (a Bhikubhai Basiya, (b) Mr. Nilendra	g, Rajkot - 360005; S/o Mr. Bhikubhai galow, Block No.1, pany, partnership a) Mr. Kuldeepsinh kumar B Basiya, Plaza, Near Circuit	under C 6587000 along v intere	DD A/c No. 100033601 with future est from	situated at 3rd Floor, Star Plaza, Near Circuit House, constructed on land of City Survey Ward No.16, City Survey Words No.16, City Survey No.2547 paiki, Phulchhab Chowk, Rajkot, belonging to Mis Hindustan Trading Co. Boundaries of Property: East by: Open marginal space; West by: Office no.301; North by: Common passage;	One Lakhs Twenty Five Thousand Only) Rs.2,12,500.00 (Rupees Two Lakhs Twelve Thousand Five Hundred Only)	from 4.20 PM to 4.40 PM Rs. 10,000/-	Branch, IFSC Code - KARB0000658	

rtagger's attention is invited to the provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured asset)

or detailed terms and conditions of siske, please refer to link in Karnataka Bank's Weistelse (a, www.karnatakank.com under the head "Mortgaged Assets for Sale".
The E-auction will be conducted through portal https://bankauctions.in or 17.08.2023 at the above mentioned timings with unlimited extension of 05 minutes. The E-auction will be conducted through portal https://bankauctions.in or 17.08.2023 at the above mentioned timings with unlimited extension of 05 minutes. This states above mentioned timings with unlimited extension of 05 minutes. This states are active (18.04.2023) from Medical Control of 18.04.2023 from Medical Control of 1

Sd/- Chief Manager & Authorised Office Karnataka Bank Ltd.

RP-Sanjiv Goenka Group

Registered Office: 33, Jessore Road, Dum Dum, Kolkata - 700 028
web: www.saregama.com, E-mail id: co.sec@saregama.com, Phone No.: 033-2551-2984, CIN: L22213WB1946PLC014346
Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter Ended 30 June, 2023

					(Rs in Lak	hs except as otherw	ise stated)
			Standalone			Consolidated	
Sr No	Particulars	Quarter Ended 30 June, 2023 (Unaudited)	Quarter Ended 30 June, 2022 (Unaudited)	Year Ended 31 March, 2023 (Audited)	Quarter Ended 30 June, 2023 (Unaudited)	Quarter Ended 30 June, 2022 (Unaudited)	Year Ended 31 March, 2023 (Audited)
1.	Total Income from Operations	17,931	15,764	74,849	18,086	17,588	79,025
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	5,897	5,595	24,318	5,908	5,623	24,808
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	5,897	5,595	24,318	5,908	5,623	24,808
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	4,331	4,169	18,048	4,332	4,189	18,50
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	4,324	4,163	18,054	4,288	4,164	18,688
6.	Paid-up Equity Share Capital (Face Value of Re. 1/- each)	1,928	1,928	1,928	1,928	1,928	1,928
7.	Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			1,20,220			1,21,193
8.	Earnings Per Share (of Re. 1/- each) (Not annualised except for year ended 31 March, 2023)	2.25	2.16	9.37	2.26	2.17	9.63
	Basic (Rs.) Diluted (Rs.)	2.25	2.16		2.26	2.17	9.63

- The above is an extract of the detailed format of Quarterly Financial Results for the quarter ended on 30 June, 2023 filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results for the quarter ended on 30 June, 2023 are available on stock exchange websites (www.nseindia.com and www.bseindia.com) and on the Company's website (www.saregama.com).
- Pursuant to the Scheme of Arrangement (the 'Scheme") for demerger of its E-commerce Distribution Business along with identified non-core assets (collectively referred to as "Demerged undertaking") from the Group, duly sanctioned by the National Company Law Tribunal (NCLT), Kolkata Bench vide Order dated 22 June 2023 ("Order"), with effect from the Appointed Date i.e., 1 April 2022, the E-commerce Distribution Business along with identified non-core assets (the demerged undertaking ') of the Group ("Demerged Company") stands transferred into the "Digidrive Distributors Limited" ('the resulting company'). Consequently, figures for the quarter ended 30 June 2022, 30 June 2023 and year ended 31 March 2023 have been reclassified to represent the figures of the remaining businesses of the Group. Pursuant to Scheme becoming effective two wholly-owned subsidiaries of the Group, Open Media Network Private Limited and Digidrive Distributors Limited ceases to be subsidiaries from the Appointed Date i.e. 1 April 2022.
- The above unaudited standalone/consolidated financial results for the quarter ended 30 June, 2023 have been reviewed and recommended by the Audit Committee in their meeting held on 27 July, 2023 and approved by the Board of Directors of the Company at their meeting held on even date. These results have been subjected to "limited review" by the Statutory Auditors of the Company who have issued an unmodified review report on the unaudited standalone and consolidated financial results for the quarter ended 30 June, 2023.

Place: Kolkata Date: 27 July, 2023 On behalf of the Board Vikram Mehra Managing Director



www.areenlamindustries.com

GREENLAM INDUSTRIES LIMITED

Un-audited Financial Results for the quarter ended June 30, 2023

(₹ in Lakhs)

			9	Standalone			Consolidated			
SI.	Particulars	5	Quarte	r Ended	Year Ended	Quarte	r Ended	Year Ended		
No.			30.06.2023	30.06.2022	31.03.2023	30.06.2023	30.06.2022	31.03.2023		
			(Un-Audited)	(Un-Audited)	(Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)		
1.	Total Income from Oper	rations	46,892.05	43,064.12	1,85,106.81	51,524.12	47,061.22	2,02,595.80		
2.	Net Profit/(Loss) for the	Period	4,068.62	2,692.14	15,049.08	4,367.14	3,274.44	16,410.82		
	(Before Tax and Excepti	ional Item)								
3.	. Net Profit/(Loss) for the Period		4,068.62	2,692.14	15,049.08	4,367.14	3,274.44	16,410.82		
	(Before Tax and After Ex	xceptional Item)								
4.	Net Profit/(Loss) for the	Period	3,031.51	2,012.27	12,288.06	3,223.84	2,457.15	12,803.96		
	(After Tax and After Exc	eptional Item)								
5.	Total Comprehensive In	ncome	2,831.66	1,948.84	12,259.32	3,014.53	2,652.75	13,337.60		
6.	Paid up Equity Share C	apital	1,269.93	1,206.82	1,269.93	1,269.93	1,206.82	1,269.93		
7.	Reserves (excluding Re	evaluation Reserve)	-	-	92,234.50	-	•	95,593.02		
8.	Securities Premium Account		-	-	19,436.89	-	-	19,436.89		
9.	Net Worth		95,276.80	64,301.55	92,401.47	98,535.36	66,922.76	95,409.12		
10.	Paid up Debt Capital/ O	Outstanding Debt	9,900.00	9,900.00	9,900.00	9,900.00	9,900.00	9,900.00		
11.	Outstanding Redeemab	ole Preference Shares	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.		
12.	Debt Equity Ratio		0.11	0.32	0.11	0.53	0.33	0.33		
13.	Earnings Per Share i.	Basic	2.39*	1.67*	9.82	2.59*	2.05*	10.27		
	(of ₹1/- each) (in ₹) ii. [Diluted	2.39*	1.67*	9.82	2.59*	2.05*	10.27		
14.	Capital Redemption Res	serve	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.		
15.	Debenture Redemption	Reserve	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.		
16.	Debt Service Coverage	Ratio (times)	3.95	3.38	3.73	3.42	3.89	3.79		
17	Interest Service Coverage	ge Ratio (times)	10.42	10.13	10.07	10.29	11.50	11.66		
18	Long term Debt to Work	king Capital (times)	0.45	0.51	0.48	1.42	0.44	0.99		
19	Current ratio (times)		1.61	1.55	1.61	1.38	1.62	1.52		
20	Bad debts to Account re	eceivable ratio (%)	0.16	0.00	0.22	0.14	0.00	0.20		
21	Current liability ratio (tin	nes)	0.31	0.35	0.32	0.31	0.36	0.32		
22	Total debts to total asse	ets (%)	18.53	22.51	19.91	31.59	22.69	27.76		
23	Debtors turnover (Days))	24	27	24	25	26	25		
24	Inventory turnover (Day	rs)	89	97	89	93	101	92		
25	Operating margin (%)		12.27	10.02	10.58	12.49	10.70	11.49		
26	Net profit margin (%)		6.46	4.67	6.64	6.26	5.22	6.32		

*Not annualised

Place: New Delhi

Date: July 27, 2023

- 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange's websites i.e. 'www.bseindia.com' and 'www.nseindia.com' and also at the website of the Company at 'www.greenlamindustries.com'.
- 2. For the other line items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 pertinent disclosures have been made to the Stock Exchanges and can be accessed on their websites
- The Company does not have any Extraordinary item to report during the above periods.
- The Company has not discontinued any of its operations during the above periods.

By order of the Board Saurabh Mittal **Managing Director & CEO** [DIN: 00273917]

Corporate Identity Number: L21016DL2013PLC386045 Registered & Corporate Office: 203, 2nd Floor, West Wing, Worldmark 1, Aerocity, IGI Airport, Hospitality District, New Delhi - 110037, India

 $Phone: \verb§+91-11-42791399; Email: investor.relations@greenlam.com; Website: www.greenlamindustries.com investor.relations.greenlamindustries.com investor.relations.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries.greenlamindustries$











Shrenik Limited

CIN: L51396GJ2012PLC073061 Registered Office: 505-508, TEN/11, Beside Mardia Plaza, C.G. Road, Ahmedabad - 380 009, Gujarat. Tel.: (079) 26440303Telefax: (079) 26406810 Email: cs@shrenik.co.in Website: www.shrenikltd.con

Extract of the Statement of the Unaudited Financial Results for the guarter ended 30th June, 2023

SI. No.	Particulars	Quarter ended 30th June, 2023	Quarter ended 30th June, 2022	Year ended 31 st March, 2023		
1.	Total Income from Operations	859.84	1199.52	4855.63		
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4880.70)	83.04	8.93		
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(4745.02)	83.04	11.26		
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4745.02)	83.04	22.94		
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(4745.02)	83.04	22.94		
6.	Equity Share Capital	6120	6120	6120		
7.	Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) - 1. Basic:					
	2. Diluted:	(0.77)	0.01	0.00		

The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarte The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter ended on 30th June, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter ended on 30th June, 2023 is available on the website of National Stock Exchange of India i.e. www.nseindia.com and on the website of the Company i.e. www.shrenikltd.com.

For and on behalf of the Board of Directors

Address: Ernst & Young LLP, 3rd Floor, Worldmark 1,

Aerocity Hospitality, New Delhi, National Capital Territory

Place : Ahmedabad Date : 27.07.2023

Shrenik Vima Chairman & Managing Director

FORM A PUBLIC ANNOUNCEMENT

(Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India asolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

FOR THE ATTENTION OF THE CREDITORS OF **COFFEE DAY GLOBAL LIMITED** RELEVANT PARTICULARS Name of corporate debtor Coffee Day Global Lir Date of incorporation of corporate debtor Authority under which Authority under which corporate debtor RoC-Bangalore is incorporated / registered U85110KA1993PLC015001

4. Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor Address of the registered office and Registered Office: No. 23/2, Coffeeday Square Vitta principal office (if any) of corporate Mallya Road Bangalore 560001 debtor Insolvency commencement date in respect of corporate debtor 21/01/2024 (from the date of receipt of the order resolution process Name and registration number of the IBBI/IPA-001/IP-P00304/2017-2018/10568 insolvency professional acting as interim resolution professional Address: Ernst & Young LLP, 3rd Floor, Worldmark 1, Address and e-mail of the interim Aerocity Hospitality, New Delhi, National Capital Territory with the Board Delhi-110037. Email Id: Shailendra.ajmera@in.ey.con

esolution professional Delhi-110037 Email ld: cirp.ccd@gmail.com 11. Last date for submission of claims 08/08/2023 (from the date of receipt of the order) Classes of creditors, if any, unde clause (b) of sub-section (6A) of section 21, ascertained by the interim resolutio professional 13. Names of Insolvency Professionals Not Applicable

identified to act as Authorised Representative of creditors in a class (Three names for each class) Web link (b) Details of Authorized Representatives https://ibbi.gov.in/en/home/downloads are available at: Notice is hereby given that the National Company Law Tribunal. Bengaluru Bench has

ordered the commencement of a corporate insolvency resolution process of the Coffe Day Global Limited on 20 July 2023 (order received on 25 July 2023). The creditors of Coffee Day Global Limited, are hereby called upon to submit their claim with proof on or before 8 August 2023 to the interim resolution professional at the add mentioned against entry No. 10. The financial creditors shall submit their claims with proof by electronic means only. Al

other creditors may submit the claims with proof in person, by post or by electr Submission of false or misleading proofs of claim shall attract penalties. Signature of Interim Resolution Professional: Sd/ame of Interim Resolution Professional: Mr. Shailendra Ajmera

Date: 28/07/2023

LO. Address and e-mail to be used for

correspondence with the interim

કબજા નોટિસ (સ્થાવર મિલકત માટે)

જે અંતર્ગત.

કે જે સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શનુ ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટ્રેસ્ટ એક્ટ 2002 ેહેઠળ **ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ("આઈએચએફએલ")** ના અધિકૃત અધિકારી છે અને કલમ 13(12) ना वांचन साथे सि**ક्यु**रीटी र्एन्ट्रेस्ट (એન્ફોર્સમેન્ટ) नियम 2002 ना नियम 3 हेहળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં 20.04.2022 ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ખરીદદારો **પુરષોત્તમભાઇ અર્જુનભાઈ કાલે પ્રોપ્રાઈટર સાઈ કુરિચર્સ** અને મનીષા પુરષોત્તમભાઈ કાલે ઉર્ફે મનીષા પુરસોત્તમભાઈ કાલે પ્રોપ્રાઈટર સાઈસ્ એડલાઈફ ફિટનેસ ને નોટિસમાં જણાવેલી **આઇએચએફએલ લોન ખાતું નં**. HLAPSUR00330159 સામે કથિત સચના પ્રાપ્ત થયાની તારીખથી 60 દિવસની અંદર હકીકતમાં ચકવણી થાય ત્યાં સુધી 13.04.2022 થી વ્યાજ દરે રૂ.38,62,015.42 (રૂપિયા આડગ્રીસ લાખ બાંસઠ હજાર **પંદર અને બેતાલીસ પૈસે માત્ર)** ની સૂચનામાં ઉલ્લેખ કરાયેલી રકમની ભાવિ વ્યાજે ચુકવણીની તારીખ સુધી પુનઃ ચુકવણી કરવા માટે આ સાથે જાણ કરવામાં આવેલ છે. વધુમાં **આઇએચએફએલ** તરીકે તારીખ 27.06.2023 ના અસાઈનમેન્ટ કરાર દ્વારા એસેંટ્સ કેઅર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝ લિમિટેડ ("એસીઆરઈ") ની તરફેણમાં તેના તમામ અધિકારો, શીર્ષક અને ઉપરોક્ત લોન ખાતાનું વ્યાજ સોંપ્યું છે અને લોન ખાતું જેને **એસીઆરઈ** ની બુક્સમાં લોન ખાતું નં. HLAPSUR00330159 તરીકે કરીથ નંબર આપ્યો છે.

કર્ષદાર આ રકમ ચુકવવામાં નિષ્ફળ જવાથી સામાન્ય જનતાને આ દ્વારા સૂચના આપવામાં આવે છે કે, નીચે સહી કર્તા દ્વારા સિક્યુરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) - રૂલ્સ -2002 સચિત કાયદો નિયમ 8 સાથે વાંચતા તેની કલમ 13 ની પેટા - કલમ (4) ਨੇਠળ તેને અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણન કરાયેલી મિલકતનો **કબ્જો** તારીખ 22.07.2023 ના રોજ લેવામાં આવ્યો છે.

ખાસ કરીને કર્જદાર અને જાહેર જનતાને અત્રે ચેતવવામાં આવે છે કે કથિત મિલકતના સોદામાં પડવું નહી અને જો તે મિલકતને લગતા કોઈ પણ સોદા કરવામાં આવશે તો 3.38.62.015.42 (રૂપિયા આડગ્રીસ લાખ બાંસઠ હજાર પંદર અને બેતાલીસ પૈસે માત્ર) 13.04.2022 ની તારીખથી અને તેના ઉપર ચડત વ્યાજ **એસેટ્સ કેઅર એન્ડ રિકન્સ્ટ્રક્શ**ન **એન્ટરપ્રાઈઝ લિમિટેડ** ના હકને આધીન રહેશે.

સુરક્ષીત અસ્કથામતોને પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં અધિનિયમની કલમ 13 ની પેટા કલમ (8) ની જોગવાઈ મુજબ ઉધાર લેનાર નું ધ્યાન દોરવામાં (આમંત્રિત) કરવામાં આવે છે.

સ્થાવર મિલકતનું વર્ણન મિલકત નંબર 1

પ્રિમિસીસ બેરિંગ ઓફિસ નંબર 201 (પાસિંગ પ્લાન ત્રીજા માળની ઓફિસ નંબર 1 મુજબ) સુપર બિલ્ટ અપ એરિયા માપન 3225 સ્ક્વેર ફીટ એટલે કે 299.72 સ્ક્વેર મીટર્સ અને કાર્પેટ એરિયા માપન 1645.10 સ્ક્વેર ફીટ એટલે કે 152.89 સ્ક્વેર મીટર્સ, જમીન બેરિંગ રેવેન્યુ સર્વે નંબર 39 પર સ્થિત જમીન પર નાહતા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસિત "રાજપોઈન્ટ" માં બીજો માળ પર ભોંચતળિચુંમાં અવિભાજિત શેર સાથે, બ્લોક નંબર 68, ટી.પી. સ્કીમ નંબર 8 (પાલનપુર), અંતિમ પ્લોટ નંબર 16 પાઈકી ભાગ-

2 માપન 1422 સ્ક્વેર મીટર્સ, ગામ પાલનપુર માં બિનખેતીની જમીન પાઈકી, જિલ્લો

મિલકત નંબર 2

સુરત, સુરત-395009, ગુજરાત.

પ્રિમિસીસ બેરિંગ ઓફિસ નંબર 202 (પાસિંગ પ્લાન ત્રીજા માળની ઓફિસ નંબર 2 મુજબ) સુપર બિલ્ટ અપ એરિયા માપન 502 સ્ક્વેર ફીટ એટલે કે 46.65 સ્ક્વેર મીટર્સ અને કાર્પેટ એરિયા માપન 256.20 સ્ક્વેર ફીટ એટલે કે 23.89 સ્ક્વેર મીટર્સ, જમીન બેરિંગ રેવેન્યુ સર્વે નંબર 39 પર સ્થિત જમીન પર નાહતા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસિત "રાજપોઈન્ટ" માં બીજો માળ પર ભોંચતળિયુંમાં અવિભાજિત શેર સાથે, બ્લોક નંબર 68, ટી.પી. સ્કીમ નંબર 8 (પાલનપુર), અંતિમ પ્લોટ નંબર 16 પાઈકી ભાગ-2 માપન 1422 સ્ક્વેર મીટર્સ, ગામ પાલનપુર માં બિનખેતીની જમીન પાઈકી, જિલ્લો સુરત, સુરત-395009, ગુજરાત.

મિલકત નંબર 3

પ્રિમિસીસ બેરિંગ ઓફિસ નંબર 203 (પાસિંગ પ્લાન ત્રીજા માળની ઓફિસ નંબર 3 મુજબ) સુપર બિલ્ટ અપ એરિયા માપન 502 સ્ક્વેર ફીટ એટલે કે 46.65 સ્ક્વેર મીટર્સ जने डार्पेंट ओरिया भापन 256.20 स्डवेर झीट એटले डे 23.89 स्डवेर मीटर्स, જभीन બેરિંગ રેવેન્યુ સર્વે નંબર 39 પર સ્થિત જમીન પર નાહતા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસિત "રાજપોઈન્ટ" માં બીજો માળ પર ભોંચતળિયુંમાં અવિભાજિત શેર સાથે, બ્લોક નંબર 68, ટી.પી. સ્કીમ નંબર 8 (પાલનપુર), અંતિમ પ્લોટ નંબર 16 પાઈકી ભાગ-2 માપન 1422 સ્ક્વેર મીટર્સ, ગામ પાલનપુર માં બિનખેતીની જમીન પાઈકી, જિલ્લો સુરત, સુરત-395009, ગુજરાત.

સહી/-

અધિકૃત અધિકારી તારીખ : 22.07.2023 એસેટ્સ કેઅર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝ લિમિટેડ

QSB| ભારતીચ સ્ટેટ બેંક

સ્ટ્રેસ્ડ એસેટ્સ રીકવરી શાખા (એસએઆરબી) : પહેલો માળ, રત્ના આર્ટેમ્સ, ૪૨, સરદાર પટેલ નગર ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા પાસે, ઑફ સી જી રોડ, એલીસબ્રીજ, અમદાવાદ - ૩૮૦૦૦૬.

પ્રત્યક્ષ કબજા નોટીસ (અસ્થાવર મિલકત માટે)

આથી, નીચે સહી કરનાર ભારતીય સ્ટેટ બેંકના અધિકૃત અધિકારીશ્રીએ સીકયોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટકશન ઑફ ફાયનાન્શીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ २००२ अंतर्गत अने सिड्योरिटी ઈन्टरेस्ट (अन्डोर्समेन्ट) उत्स, २००२ ना नियम उ सार्थ વંચાતી કલમ ૧૩ (૧૨) અંતર્ગત આપવામાં આવેલી સત્તાની રૂએ **તા. ૦૬.૧૦.૨૦૨૨** ના રોજ ડીમાન્ડ નોટીસ જારી કરેલ જેમાં કરજદાર/મિલકતના માલિક/ગીરોદાર **શ્રી જૈનમ મિનેષભાઈ** ખારાને બેંકને ચૂકવવાના રા. ૯૯,૮૩,૬૨૬.७૩ (રા. નવ્વાણું લાખ ત્યાંસી હજાર છસ્સો છલ્લીસ અને પૈસા તોત્તેર માત્ર) તા. 05.૧૦.૨૦૨૨ સુધીના સાથે તા. ૦७.૧૦.૨૦૨૨ થી મવિષ્યનું વ્યાજ, કોસ્ટ, ચાર્જીસ વગેરે (તા. ૦૬.૧૦.૨૦૨૨ ની કિમાન્ડ નોટીસ પછી રીકવર કરેલ રકમ બાદ) સાથે સદર નોટીસ જારી થયાના ૬૦ દિવસમાં ચુકવવા જણાવેલ હતું.

કરજદાર બાકી રકમ ચુકવવામાં કસુરવાર થતાં કરજદાર, જામીનદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે ઉક્ત અધિનિયમની ધારા ૧૩(૪) સાથે જણાવેત નિયમો સાથે વંચાતા નિયમ ૮ દેઠળ મળેલ સત્તાની રૂએ નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતનો પ્રત્યક્ષ કબજો તા. ૨૩.૦७.૨૦૨૩ ના રોજ લઈ લીધેલ છે.

કરજદાર/જામીનદારને વિશેષ રૂપથી અને જાહેર જનતાને સામાન્ય રૂપે સૂચિત કરવામાં આવે છે કે સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર કરવો નહીં અને જો આ મિલકત સાથે કોઈપણ જાતનો વ્યવहાર ભારતીય સ્ટેટ બેંકની બાકી રકમ રૂા. ૯૯,૮૩,૬૨૬.७૩ (રૂા. નવ્વાણું લાખ ત્યાંસી હજાર છસ્સો છવ્વીસ અને પૈસા તોત્તેર માત્ર) તા. ૦૬.૧૦.૨૦૨૨ સુધીના સાથે મવિષ્યનું વ્યાજ, કોષ્ટ, ચાર્જીસ વગેરેના **બોજાને આધીન રહેશે.**

''સરફૈસી કાચદાની કલમ[ે]૧૩ ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે કરજદારનું સિક્યોર્ડ એસેટસ છોડાવવા માટે મળવાપાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે. અસ્થાવર મિલકતનું વિવરણ

ટેનામેન્ટ નં. સી–૨૦, ક્ષેત્રફળ ૨૨૦.૩૪ સ્કે. મીટસ (બિલ્ડ અપ એરિયા) ગ્રાઉન્ડ ફ્લોર,

પહેલો માળ. બીજો માળ અને સેલસ સાથે રાણા કો-ઓપરેટીવ ઠાઉસીંગ સોસાયટી લિમિટેડ ની જમીનના અવિભાજીત શેર, ચંદ્ર પ્રકાશ સોસાયટી પાસે, ફુટબોલ ગ્રાઉન્ડ સામે, એડીસી બેંક કાંકરીયા શાખા પાછળ, કાંકરીયા, એફ.પી. નં. ૧૧७, ટી.પી.એસ. નં. ૦૨, મોજે રાજપુર – હિરપુરા, જીદ્યો અમદાવાદની અચલિત મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે.

તારીખઃ ૨૩.૦७.૨૦૨૩ સહી/- અધિકૃત અધિકારી સ્થળઃ અમદાવાદ (२देट जेन्ड ઇन्डिया)

SUPRAJIT ENGINEERING LIMITED

CIN: L29199KA1985PLC006934

Registered & Corporate Office: No. 100&101, Bommasandra Industrial Area Bengaluru - 560 099, Telephone: +91+80-43421100, Fax: +91-80-27833279 Email: investors@suprajit.com, Web: www.suprajit.com

NOTICE

SUB: Transfer of Unclaimed Dividends and Equity Shares of the

Company to Investor Education and Protection Fund(IEPF). The Notice is published pursuant to Rule 6(3)(a) of the Investor Education and Protection Fund Authority(Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2017(the Rules) read with Section 124(6) of the Companies Act, 2013(The ACT) notified by the Ministry of Corporate Affairs and as amended from time to time.

The Rules interalia contain provisions of transfer of all the shares in respect of which dividend has not been paid or claimed by the share holders for seven consecutive years or more to the DEMAT Account of Investor Education and Protection Fund Authority(herein after referred to as "Authority")

In compliance with the requirements set out in the Rules, the Comapny has sent individual notices to the concerned shareholder(s) at their latest available address as per the Company's/RTA's records, that, their shares and dividends unclaimed by them are liable to be transferred to the Authority under the said

The Company has uploaded full details of such shareholders and shares due for transfer to DEMAT account of the Authority on its website at www.suprajit.com

The concerned shareholder(s) holding shares in physical forms and whose shares are liable to be transferred to the Authority may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of transfer of shares to the Authority as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in their names will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to DEMAT Account of the Authority by the due date as per proceedure stipulated in the Rules.

In case the Comapny does not receive any communication from the concerned share holders by October 10,2023 or such other date as may be extended, the Company shall with a view to complying with the requirements set our in the Rules, transfer the shares and unclaimed dividend to the Authority by the due date as per proceedures stipulated in the Rules.

Shareholders may note that both the unclaimed dividend and the shares transfered to IEPF including all benefits accuring on such shares, if any, can be claimed back by them from Authority after following the proceedure prescribed by the Rules.

In case the share holders have any queries on the subject matter and the Rules, they may contact the Company's Share Transfer Agent at Integrated Registry Management Services Private Limited, No.30, Ramana Residency,4th Cross, Sampige Road, Malleswaram, Bangalore - 560 003 Tel(080)2346 0815 to 818 Fax (080)2346 0819 EMail ID

Place: Bangalore

For SUPRAJIT ENGINEERING LIMITED Medappa Gowda J Company Secretary & Compliance Officer. Date: July 27, 2023.

કબજા નોટિસ

જે અંતર્ગત. કે જે સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શનુ ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટ્રેસ્ટ એક્ટ 2002 હેઠળ **ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ("આઈએચએફએલ")** ના અધિકૃત અધિકારી છે અને કલમ 13(12) ना वांचन साथे सिड्युरीटी र्एट्रेस्ट (એन्ड्रोर्समेन्ट⁾ नियम 2002 ना नियम 3 हेहज આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતાં 04.06.2021 ના રોજ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં ખરીદદારો પુરષોત્તમભાઈ અર્જુનભાઈ કાલે પ્રોપ્રાઈટર સાઈ કુરિચર્સ અને મનીષા પુરસોત્તમભાઈ કાલે ને નોટિસમાં જણાવેલી આઇએચએફએલ લોન ખાતું નં. HLAPSUR00253666 સામે કથિત સૂચના પ્રાપ્ત થયાની તારીખથી 60 દિવસની અંદર હકીકતમાં ચુકવણી થાય ત્યાં સુધી 27.05.2021 થી વ્યાજ દરેરૂ.1,48,82,076.14 **(રૂપિયા** એક કરોડ એડતાલીસ લાખ બ્યાંસી હજાર છોતેર અને ચૌદ પૈસે માત્ર) ની સૂચનામાં ઉલ્લેખ કરાયેલી રકમની ભાવિ વ્યાજે ચુકવણીની તારીખ સુધી પુનઃ ચુકવણી કરવા માટે આ સાથે જાણ કરવામાં આવેલ છે. વધુમાં **આઇએચએકએલ** તરીકે તારીખ 27.06.2023 ના અસાઈનમેન્ટ કરાર દ્વારા **એસેટ્સ કેઅર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝ લિમિટેડ** ("**એસીઆરઇ**") ની તરફેણમાં તેના તમામ અધિકારો, શીર્ષક અને ઉપરોક્ત લોન . ખાતાનું વ્યાજ સોંપ્યું છે અને લોન ખાતું જેને **એસીઆરઈ** ની બુક્સમાં લોન ખાતું નં. HLAPSUR00253666 તરીકે કરીય નંબર આપ્યો છે.

કર્ષદાર આ રકમ ચુકવવામાં નિષ્ફળ જવાથી સામાન્ય જનતાને આ દ્વારા સૂચના આપવામાં આવે છે કે, નીચે સહી કર્તા દ્વારા સિક્યુરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) - રૂલ્સ -2002 सूचित डायहो नियम 8 साथे वांचता तेनी इसम 13 नी पेटा - इसम (4) हैं हुए तेने અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે વર્ણન કરાયેલી મિલકતનો **કબ્જો** તારીખ 22.07.2023 ના રોજ લેવામાં આવ્યો છે.

ખાસ કરીને કર્જદાર અને જાહેર જનતાને અત્રે ચેતવવામાં આવે છે કે કથિત મિલકતન સોદામાં પડવું નહી અને જો તે મિલકતને લગતા કોઈ પણ સોદા કરવામાં આવશે તો રૂ.1,48,82,076.14 (રૂપિયા એક કરોડ અડતાલીસ લાખ બ્યાસી હજાર છોતેર અને ચૌદ પૈસે માત્ર) 27.05.2021 ની તારીખથી અને તેના ઉપર ચડત વ્યાજ **એસેટ્સ કેઅર એન્ડ રિકન્સ્ટક્શન એન્ટરપ્રાઈઝ લિમિટેડ** ના હકને આધીન રહેશે.

સુરક્ષીત અસ્કચામતોને પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં અધિનિયમની કલમ 13 ની પેટા કલમ (8) ની જોગવાઈ મુજબ ઉધાર લેનાર નું ધ્યાન દોરવામાં (આમંત્રિત) કરવામાં આવે છે

સ્થાવર મિલકતનું વર્ણન

भिલકत नं. 1 દુકાન નં. 201 માપન 3225 સ્ક્વેર ફીટ એટલે કે 299.72 સ્ક્વેર મીટર્સ સુપર બિલ્ટ અપ

એરિયા અને માપન 1645.10 સ્ક્વેર ફીટ એટલે કે 152.89 સ્ક્વેર મીટર્સ કાર્પેટ એરિયા, ગ્રાઉન્ડ લેન્ડ "બીજો માળ" "રાજપોઈન્ટ" માં અવિભાજિત શેર સાથે, રેવેન્યુ સર્વે નં. 39, બ્લોક નં. 68, ટી.પી. સ્ક્રીમ નં.-8, (પાલનપોર), અંતિમ પ્લોટ નં.-16, પાઈકી ભાગ-2, માપન 1422 સ્ક્વેર મીટર્સ, એન.એ. લેન્ડ પાઈકી, ગામ પાલનપોર, સરત - 395009. ગુજરાત.

भिલકत नं. 2

हुडान नं. 202 भापन 502 स<mark>्ड</mark>वेर ड़ीट એटले डे 46.65 स्डवेर मीटर्स सुपर બિલ્ટ અप એરિયા અને માપન 256.20 સ્ક્વેર ફીટ એટલે કે 23.89 સ્ક્વેર મીટર્સ કાર્પેટ એરિયા, ગ્રાઉન્ડ લેન્ડ "બીજો માળ" "રાજપોઈન્ટ" માં અવિભાજિત શેર સાથે, રેવેન્યુ સર્વે નં. 39, બ્લોક નં. 68, ટી.પી. સ્ક્રીમ નં.-8, (પાલનપોર), અંતિમ પ્લોટ નં.-16, પાર્ઘકી ભાગ-2, માપન 1422 સ્ક્વેર મીટર્સ, એન.એ. લેન્ડ પાઈકી, ગામ પાલનપોર, સુરત - 395009, ગુજરાત.

મિલકત નં. 3

हुडान नं. 203 मापन 502 स्डवेर झीट એटले डे 46.65 स्डवेर मीटर्स सुपर બિલ્ટ અप એરિયા અને માપન 256.20 સ્ક્વેર ફીટ એટલે કે 23.89 સ્ક્વેર મીટર્સ કાર્પેટ એરિયા, ગ્રાઉન્ડ લેન્ડ "બીજો માળ" "રાજપોઈન્ટ" માં અવિભાજિત શેર સાથે, રેવેન્યુ સર્વે નં. 39, બ્લોક નં. 68, ટી.પી. સ્કીમ નં.-8, (પાલનપોર), અંતિમ પ્લોટ નં.-16, પાઈકી ભાગ-2, માપન 1422 સ્ક્વેર મીટર્સ, એન.એ. લેન્ડ પાઈકી, ગામ પાલનપોર, સુરત - 395009, ગુજરાત.

અધિકૃત અધિકારી તારીખ : 22.07.2023 એસેટ્સ કેઅર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝ લિમિટેડ स्थण : सुरत